

B.Com. Semester - 3 (NEP-2020) Examination**OCT/NOV-2024****International Financial Reporting Standards (Multidisciplinary Course)****Time: 2:00 Hours****Marks: 50****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) ના અમલીકરણના ફાયદાઓ સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન.૧ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) ના સિદ્ધાંતો શું છે?
- પ્રશ્ન.૨ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) અપનાવવાની પ્રક્રિયા સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન.૨ ભારતીય જી.એ.એ.પી.(Indian GAAP) અને આઈ.એફ.આર.એસ(IFRS) વચ્ચેનો તફાવત સમજાવો.
- પ્રશ્ન.૩ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) મુજબ અદ્રશ્ય મિલકતોનું વર્ણન કરો. (૧૦)
અથવા
- પ્રશ્ન.૩ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) મુજબ વાજબી મૂલ્ય માપનનું વર્ણન કરો.
- પ્રશ્ન.૪ નાના અને મધ્યમ કદના એકમો (SMEs) ની રિપોર્ટિંગ આવશ્યકતાઓ શું છે. (૧૦)
અથવા
- પ્રશ્ન.૪ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) હેઠળ શેર દીઠ કમાણી સમજાવો.
- પ્રશ્ન.૫ આંતરરાષ્ટ્રીય નાણાકિય અહેવાલ ધોરણો(IFRS) ના અમલીકરણની મર્યાદાઓ સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન.૫ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બોર્ડ(IASB) ની ભૂમિકાનું વર્ણન કરો.

ENGLISH VERSION

- Que.1 Explain the benefits to implement IFRS. (10)
OR
- Que.1 What are the principles of IFRS?
- Que.2 Explain the process of IFRS adoption. (10)
OR
- Que.2 Difference between Indian GAAP and IFRS
- Que.3 Describe Intangible Assets as per IFRS. (10)
OR
- Que.3 Describe Fair Value Measurement as per IFRS.
- Que.4 What are Reporting requirements of Small and medium sized entities (SMEs). (10)
OR
- Que.4 Earnings per Share under IFRS.
- Que.5 Explain the limitations in implementation of IFRS. (10)
OR
- Que.5 Describe the role of International Accounting Standard Board(IASB).
